7. JAMSHEDJI TATAROAD. CHURCHGATE RECLAMATION. MUMBAI-400 020 Ph: 022 - 2282 0048, E-mail: gpel@kilachand.com, Website: www.gpelindia.in

Date: 2nd August, 2023

To Head Listing Compliance BSE Ltd. Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400 001.

Company Code - 517288

Dear Sir/ Ma'am,

Sub: Newspaper Publication for Un-Audited Financial Results for the quarter ended 30th June, 2023

We forward herewith extract of publication for Statement of Standalone Un-Audited Financial Results for the quarter ended 30th June, 2023, published in newspaper viz. The Indian Express (English Edition) Ahmedabad and Financial Express (Gujarati Edition) Ahmedabad, both dated 2nd August, 2023 as required.

The above is for your information.

Thanking You.

Yours faithfully,

For and on behalf of Gujarat Poly Electronics Limited

Nivedita Nambiar Company Secretary and Compliance Officer FCS: 8479

3 GUJARAT

GIFT City gets 4,103 residential units as 2-yr-long clause ends

the two-year long "sunset clause" — permitting anyone to own a house and live in GIFT City - attracted a total of 10 developers who have pledged to construct 4,103 housing units at the site where currently only office spaces are functional.

"The sunset clause, which ended in March this year, was not fully subscribed. However, from now, there will be no relaxation for residential projects to allow outsiders to occupy houses in GIFT City," Tapan Ray, Managing Director and Group CEO of GIFT City, told *The Indian Express*.

"Initially, the houses were meant only for those working at GIFT City. Then, regulation regarding the ownership was relaxed allowing outsiders to own houses, but occupants have to be those working at GIFT City. That was relaxed allowing anyone to own and occupy houses in the project and a cap of such houses was set at 5,000 housing units," Ray added.

Over the past couple of years, several stakeholders and partners have lamented the absence of "life" after work hours at GIFT City.

Though the subscription, as far as absolute numbers, might have fallen short of the targeted number of 5,000 housing units, officials point out that the total area intended for promoting housing initially at GIFT City has been met. These homes will cost at least 30-40 per cent more than those outside of the smart city area.

Among the 10 under construction or proposed housing projects that took advantage of the "sunset clause", five are located in the non-processing area of SEZ (Special Economic Zone) at GIFT City where there are no exemptions in the local laws unlike the processing area.

The developers include Savvy ATS Realty, Shivalik LLP, Shilp Infraspaces LLP, Bakeri Residences LLP and Bhandari and Sangath Builders LLP. Similarly, the housing projects in Domestic Tariff Area (DTA) belong to Sobha Ltd, Sangath IPL, Nila Spaces, Kaavyaratna LLP and State Bank of India. The SBI housing project will be meant for its own employees. Barring Bengalurubased Sobha Ltd and M/s Bhandari, all other residential developers are either based out of Ahmedabad or Gandhinagar.

The biggest housing project belongs to Bengaluru-based Sobha Ltd, which is building 742 housing units. These units are divided into two separate projects.

Katni-Singrauli section".

Estimated Cost of the work



absence of 'life' after work hours at GIFT City. File

BUILDERS & BUILDINGS HOUSING UNITS DEVELOPER Sangath IPL 336 Sobha Ltd 742 Kaavyaratna LLP. 453 Nila Spaces. 496 173 State Bank of India 262 Savvy ATS Realty 372 Shivalik LLP. Shilp Infraspaces LLP 646 **Bakeri Residences LLP** 395 Bhandari & Sangath **Builders LLP**

The Indian Express had reported that the Gujarat government, in a resolution passed on March 8, 2021, tweaked the rules allowing people not working at GIFT City to own and reside in a house built inside the campus. The rules were changed because

GIFT City started out with the walk-to-work concept where everyone who worked here would have to live here. However, with residential units still under construction, most of the employees live outside the campus, either in Gandhinagar

or Ahmedabad, and commute to

there was a lack of interest among

real-estate developers to adhere

to the earlier restrictive clauses.

work on private vehicles. The first housing project comprising 330 units was executed by Janaadhar Pvt Ltd. They are currently occupied by the blue-collared employees in the smart city. Thereafter, Sobha Ltd and Gandhinagar-based Sangath IPL stepped in to build the homes.

Cost of houses

The cost of a residential unit

4,103 RESIDENTIAL UNITS - from a 1-BHK studio apartment to 4-BHK or penthouse unit – can vary between Rs 70 lakh to more than Rs 4 crore. "The cost of a residential unit in the project is between Rs 5,500 and Rs 6,000 per square feet. This is about 30-40 per cent more than the cost of residential schemes outside the

> When asked if the 4,103 housing units would be enough to kick-start an "evening life" in GIFT City — where only 300 odd families currently live — Mota said, "It is no to suffice. But the residential schemes that will come up as part of the proposed GIFT City expansion is expected to not have any such restrictions and will help add to the social ecosystem that is already getting built in GIFT City."

and Wakefield (C&W).

THIRD CASE IN WHICH HE HAS BEEN BOOKED

Tathya Patel held for ramming car into cafe on July 3

EXPRESS NEWS SERVICE AHMEDARAD AUGUST 1

THE AHMEDABAD City Police Tuesday arrested Tathya Patel, who is in jail for allegedly mowing down nine persons at the Iskcon flyover on July 20, for allegedly ramming a Mahindra Thar into a cafe on the Sindhu Bhavan Road (SBR) on July 3. This is the third case in which Patel

has been booked after he was arrested in the Iskcon flyover case.

Patel was brought to the court by N Division Traffic Police, which has his custody in the Iskcon flyover case. The court sent him to iudicial custody in connection to ramming his Thar into the wall of Mauve Cafe on SBR.

A police officer said Patel was brought for interrogation from the Sabarmati Central Jail on a transfer warrant issued by the

court. He was interrogated for six to seven hours and then returned to the jail.

According to the police, Patel and his friends had gone to a cafe on SBR around 4 am on July 3. While leaving, he rammed into the wall of Mauve Cafe. "During interrogation, Tathya and his friends confessed about crashing into the wall of the cafe," an officer said.

"We brought him to the N

Traffic Police Station around 4 pm, completed our formalities and sent him back to central jail,' a senior officer said.

Mihir Shah, the owner of the Mauve Cafe, had filed a complaint in this regard, following which an FIR was registered on July 22.

Mukesh Mondal, the manager of the restaurant told The Indian Express on Tuesday that the wall was repaired last

Patel has been booked for mowing down a crowd with his Jaguar on the Iskcon flyover early July 20, killing nine persons, including two policemen and a Homeguard jawan. Following this, he was booked in a criminal case on July 27 for allegedly ramming the same car at a temple pillar at Vansajada village in Gandhinagar in the early hours of January 1.

HC dismisses PIL seeking live-streaming of GIC proceedings

EXPRESS NEWS SERVICE AHMEDABAD, AUGUST 1

THE GUJARAT High Court Tuesday dismissed a public interest litigation that sought the live-streaming of proceedings at the Gujarat Information Commission (GIC) on the ground that the court has no authority to mandate the same and is a matter of policy.

The petition sought HC's direction to GIC to livestream its proceedings so as to bring in "transparency in the procedure adopted by them". The PIL was moved by two RTI activists — Saumil Rajpara and Dipesh Joshi - associated with the forum RTI Ekta Manch.

The division bench of Chief Justice Sunita Agarwal and Justice NV Anjaria observed that according to the material brought on record by the petitioners, it was evident that some process in this regard was initiated and information to that effect was provided to the petitioners. "Live-streaming is a matter of policy and would require infrastructure; we cannot mandate live-streaming by issuing any positive mandamus... No cause has been espoused before us that would require interference of this court for the larger public interest...It is open for the petitioners to seek information about the progress in the matter by moving a proper application," the bench held while dismissing

Remarking that "everything cannot be live-streamed", CJ Agarwal added that "livestreaming cannot be mandated by the court, it is about the infrastructure". "If they are considering it, they will do it. Where's the occasion for us to interfere? Every tribunal and forum cannot be expected to live-stream the proceedings... There is no occasion to issue any mandate at this moment...No public interest is made out by this," CJ Agarwal remarked orally.

DIVERSIFYING PORTFOLIO,

www.gmdcltd.com

At Gujarat Mineral Development Corporation Ltd. (GMDC), India's No.1 Merchant Seller of Lignite, we are scaling our efforts to further the highs achieved last year. Enabling our transformative progress is a meticulously designed roadmap that's paving the way for a range of groundbreaking initiatives. As we expand our frontiers, we look at maintaining the momentum of growth, while building on strengths and scale simultaneously.

GMDC has secured coal mines with high grade thermal coal, with reserves of 1.5 billion tons and annual PRC of 23 million tons. They will help us secure the energy requirements of Gujarat and the nation.

(See Regulation 47(1) (b) of the SEBI (LODR) Regulations, 2015) **UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2023**

		STANDALONE				
Sr	Particulars	Quarter ended on			Year ended on	
No.		30-Jun-2023	31-Mar-2023	30-Jun-2022	31-Mar-2023	
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	
1	Total Income from Operations (net)	76,560.27	95,175.55	115,536.55	350,144.75	
2	Net Profit for the period (before Tax and Exceptional items)	28,780.90	61,618.80	46,647.32	165,717.18	
3	Net Profit for the period before tax (after Exceptional items)	28,780.90	61,618.80	46,647.32	165,717.18	
4	Net Profit for the period after tax (after Exceptional items)	21,552.62	45,070.08	34,490.12	121,247.53	
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period after tax and Other Comprehensive Income (after tax)]	27,044.10	40,147.59	25,497.99	111,017.15	
6	Equity Share Capital	6,360.00	6,360.00	6,360.00	6,360.00	
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet)				569,581.18	
8	Earning Per Share (of ₹2/- each) (for continuing and discontinued operations) (not annualised)-					
	1. Basic: (₹)	6.78	14.17	10.85	38.13	
	2. Diluted (₹)	6.78	14.17	10.85	38.13	

		CONSOLIDATED					
Sr	Particulars Particulars		Year ended on				
No.	Turneutars	30-Jun-2023	31-Mar-2023	30-Jun-2022	31-Mar-2023		
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)		
1	Total Income from Operations (net)	76,560.27	95,175.55	115,536.55	350,144.75		
2	Net Profit for the period (before Tax and Exceptional items)	28,787.64	61,636.69	46,627.53	165,799.02		
3	Net Profit for the period before tax (after Exceptional items)	28,787.64	61,636.69	46,627.53	165,799.02		
4	Net Profit for the period after tax (after Exceptional items)	21,870.23	45,228.70	34,494.53	121,573.46		
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period after tax and Other Comprehensive Income (after tax)]	27,361.71	40,306.21	25,502.40	111,343.08		
6	Equity Share Capital	6,360.00	6,360.00	6,360.00	6,360.00		
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet)				573,468.11		
8	Earning Per Share (of ₹2/- each) (for continuing and discontinued operations) (not annualised)-						
	1. Basic: (₹)	6.88	14.22	10.85	38.23		
	2. Diluted (₹)	6.88	14.22	10.85	38.23		

Note: The above is an extract of the detailed format of Financial Results for the quarter ended on 30th June 2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 and SEBI Circular No. CIR/CFD/FAC/62/2016 dated 5th July 2016. The full format of the Financial Results for the quarter ended on 30th June 2023 alongwith Explanatory Notes is available on the Stock Exchange websites.(www.nseindia.com and

Place: Ahmedabad Date: August 01, 2023 For and on behalf of the Board of Directors Roopwant Singh, IAS Managing Director



Gujarat Mineral Development Corporation Ltd.

(A Government of Gujarat Enterprise) CIN: L14100GJ1963SGC001206



Ahmedabad

AVINASH NAIR AHMEDABAD, AUGUST 1 THOUGH UNDERSUBSCRIBED,

Several stakeholders and partners have lamented the

project in Gandhinagar and Ahmedabad," said Jigar Mota, head of transactions, Cushman

VMS INDUSTRIES LIMITED Regd. Office: 808-C, Pinnacle Business Park, Corporate Road, Prahladnagar, Ahmedabad – 380015 CIN: L74140GJ1991PLC016714 Email Id: info@vmsil.in Website: www.vmsil.in

The meeting of the Board of Directors will be held on 11th August, 2023 at Regd. Office of the Company to consider unaudited results for the Quarter ended on 30th June, 2023.

Place: Ahmedabad Date: 01.08.2023 **Company Secretary**

requirements for the work of "Design, Supply, Installation, Testing & Commissioning of Electronic Interlocking based Signaling System at Bargawan, Gondwali and Majhauli along with associated works at adjoining stations/sections in connection with doubling work in

Last Date and Time of e-Bid Submission 21.08.2023, 15:00 hrs For further details, visit website: <u>https://etenders.gov.ln/eprocure/app.</u> Corrigendum, if any, would Chief General Manager (S&T), IRCON INTERNATIONAL LIMITED st Floor, Above Maruti Suzuki Showroom, Near Jhinjhiri Police Station, NH-7, Jabalpur Road, Katni-483501

₹ 39.52.26.259.55

Vistaar Financial Services Pvt Ltd VISTAAR Registered Office: Plot No 59 & 60-23, 22nd Cross, 29th Mair BTM 2nd Stage, Bengaluru 560076. www.vistaarfinance.com

APPENDIX IV [See Rule 8 (1)] POSSESSION NOTICE (For Immovable Property)
Whereas, The undersigned being the Authorized Officer of Vistaar Financial Services Private Limited under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 09-05-2023 calling upon the Borrower(s) Mr/Mrs. Arun Gobardhan Sashmol & Mr/Mrs. Latarani Arun Sashmol to repay the amoun nentioned in the Notice being Rs. 20,58,469.10/- (Rupees Twenty Lacs Fifty Eight Thousand Four Hundred Sixty Nine and Ten Paisa Only) against Loan Account No 0148SBML00364 as on 05-05-2023 along with future interest and other charges etc till

IRCON INTERNATIONAL LTD.

e-Procurement Notice

e-Tender No.; IRCON/2065/S&T/KSD-KGS/TENDER/Pkg-1 Date 01.08,2023 e-Tender for and on behalf of **West Central Railway** is invited from bidders meeting qualifying

actual payment within 60 days from the date of receipt of the said Notice. The Borrower(s) having failed to repay the amount, Notice is hereby given to the Borrower(s) and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security nterest (Enforcement) Rules, 2002 on this the 31st day of July of the year 2023.

The Borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Vistaar Financial Services Private Limited for an amount Rs. 20,97,988.49/-(Rupees Twenty Lakh Ninety Seven Thousand Nine Hundred Eighty Eight and Forty Nine Paisa Only) as on 19-07-2023 along with future interest and other charges etc till actual payment.

The Borrowers' attention is invited to provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the Secured Assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY: All the piece and parcel of the mmovable property bearing Constructed commercial property measuring 7.34 Sq. Mtrs. Situated at city Survey Ward No. 3, Sheet No. 190 of City Survey No. 1842 paikee "Golden Gate" Scheme Shop No. 101 on First Floor, Rajkot within the following boundaries: North by: Shop No.111, South by: Wall on Road side, East by: Wall, West by: Passage & Shop No. 102

Date: 31/07/2023

Authorized Officer Vistaar Financial Services Private Limited

NOTICE By Order of the Board

GUJARAT POLY ELECTRONICS LTD. CIN: L21308GJ1989PLC012743 Regd. Office: B-18, Gandhinagar Electronic Estate, Gandhinagar - 382024, Gujarat

Ph.: 7935333658, E-mail: gpel@kilachand.com, Website: www.gpelindia.in **EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023**

(Rs. In Lakhs						
Sr.		C	Year Ended			
No.	Particulars	30.06.2023 Unaudited	31.03.2023 Audited	30.06.2022 Unaudited	31.03.2023 Audited	
1.	Total Income from Operations	503.08	550.78	406.45	2,040.88	
2.	Net Profit for the period before Tax	72.18	148.87	33.40	529.87	
3.	Net Profit for the period after Tax	72.18	148.87	33.40	529.87	
4.	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)]	72.18	140.22	32,22	517.68	
5.	Equity Share Capital	855.00	855.00	855.00	855.00	
6.	Earnings Per Share (of ₹ 10/- each) (not annualised) Basic and diluted	0.84	1.74	0.39	6.20	

(a) The above unaudited financial results were reviewed by the Audit Committe and approved by the Board of Directors of the company in its meeting held on

(b) The Statutory Auditors of the company have conducted Limited Review of the unaudited financial results as per Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. (c) The unaudited financial results for the quarter ended June 30, 2023 have been

prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules,

2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other

recognised accounting practices and policies to the extent applicable. (d) The above is an extract of the detailed format of Unaudited Quarter ended Financia Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended Financial Results are available on the Stock Exchange website

> On Behalf of Board of Directors For Gujarat Poly Electronics Limited

DIN: 00006659 EXECUTIVE CHAIRMAN Place : Mumbai Date : August 01, 2023

www.bseindia.com and our company website: www.gpelindia.in

Khanij Bhavan, 132 Feet Ring Road, Near University Ground, Vastrapur, Ahmedabad – 380 052

ગુજરાત પોલી ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ

CIN: L21308GJ1989PLC012743 રજ્ઞ. ઓફિસ: બી-૧૮, ગાંધીનગર ઇલેક્ટ્રોનિક એસ્ટેટ, ગાંધીનગર-૩૮૨૦૨૪, ગુજરાત

ટેલિફોન : ૭૯૩૫૩૩૩૬૫૮, ઈ–મેલ : gpel@kilachand.com વેબસાઈટ : www.gpelindia.i ૩૦ જૂન, ૨૦૨૩ ના પૂરા થતા ત્રિમાસિક બિનઓડિટેંડ સ્વતંત્ર નાણાંકિય પરિણામોની તારીજ

(રૂા. લાખમાં)							
ક્રમ		પૂરા	પુરૂ થતુ વર્ષ				
эч оі.	વિગતો	૩૦.૦૬.૨૦૨૩ બિનઓડિટેડ	3૧.૦૩.૨૦૨૩ ઓડિટેડ	૩૦.૦૬.૨૦૨૨ બિનઓડિટેડ	3૧.૦૩.૨૦૨૩ ઓડિટેડ		
٩.	સંચાલનથી કુલ આવક	403.06	५५०.७८	४०५.४५	२,०४०.८८		
₹.	સમયગાળા માટે ટેક્ષ પહેલાંનો ચોખ્ખો નફો	७२.१८	986.6 6	33.80	૫૨૯.૮७		
3.	સમયગાળા માટે ટેક્ષ પછીનો ચોખ્ખો નફો	७२.१८	986.60	33.80	૫૨૯.૮७		
8.	સમયગાળા માટે કુલ સર્વગ્રાહી આવક {સમયગાળા માટે નફો/(ખોટ) (ટેક્ષ પછી) અને અન્ય સર્વગ્રાહી આવક (ટેક્ષ પછી) સમાવિષ્ટ}	હર.૧૮	980.22	39.99	५९७. ५८		
ч.	ઈક્વિટી શેર મૂડી	८५५.००	८५५.००	८५५.००	८५५.००		
۶.	(રૂા. ૧૦/– ના પ્રત્યેક) શેર દીઠ કમાણી (વાર્ષિકીકૃત નથી) મૂળભૂત અને મિશ્રિત	٥.८४	9.68	0.36	ક.૨૦		
a) Guales amile a recomplant from and a area of the country and of any							

- એ) ઉપરોક્ત નાણાંકિય પરિણામોની સમિક્ષા ઓડિટ સમિતિ દ્વારા કરવામાં આવી છે અન અને ત્યારબાદ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઓગસ્ટ ૧, ૨૦૨૩ ના રોજ યોજાયેલી તેમની સંબંધિત બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
- બી) કંપનીના કાનૂની ઓડિટરોએ SEBÎ (લિસ્ટીંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન, ૨૦૧૫ ના રેગ્યુલેશન ૩૩ અનુસાર નાણાંકિય પરિણામોની સેમિક્ષા કરી છે.
- સી) જૂન ૩૦, ૨૦૨૩ ના રોજ પૂરા થતા ત્રિમાસિક નાણાંકિય પરિણામો કંપનીઝ ધારા ૨૦૧૩ની કલમ ૧૩૩ હેઠળ પ્રસ્તાવિત કંપનીઝ (ઇન્ડિયન એકાઉન્ટીંગ સ્ટાન્ડડર્સ) નિયમો, ૨૦૧૫ (Ind AS) અને લાગુ ક્ષેત્રની અન્ય માન્ય એકાઉન્ટિંગ પ્રથાઓ અન નીતિઓ અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે.
- ડી) ઉપરોક્ત પૂરા થતા ત્રિમાસિકના બિનઓડિટેડ નાણાંકિય પરિણામોની તારીજનું વિગતવાર ફોર્મેટ SEBI (લિસ્ટીંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટસ રેગ્યુલેશન, ૨૦૧૫ ના રેગ્યુલેશન ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરવામ આવ્યું છે. પૂરા થતા ત્રિમાસિકના બિનઓડિટેડ નાણાંક્ચિ પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટ સ્ટોર્ક એક્સિચેન્જની વેબસાઈટ : www.bseindia.com અને અમારી કંપનીની વેબસાઈટ : www.gpelindia.in ઉપર ઉપલબ્ધ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી, ગુજરાત પોલી ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ

ટી. આર. કિલાચંદ DIN: 00006659 તારીખ : ઓગસ્ટ ૦૧, ૨૦૨૩ કાર્યકારી અધ્યક

XCHANGING SOLUTIONS LIMITED

(a DXC Technology Company) **CIN:** L72200KA2002PLC030072 Registered Office: HP Avenue, 39/40, Electronic City Hosur Main Road, Bengaluru – 560 100, Karnataka, India **Tel:** +91 - 80 - 3387 0001

Email: compliance@xchanging.com Website: www.dxc.com NOTICE OF THE 22ND ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 22nd Annual General Meeting ("AGM") of th Members of Xchanging Solutions Limited ("XSL") "the Company") will be held on Friday, August 25, 2023 at 10:00 A.M (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the businesses, as set out in the Notice of the AGM.

The Notice of the AGM and the Annual Report, including the Standalone and Consolidated Audited Financial Statements, for the Financial Year 2022-23 has been sent only by electronic mode to those members, whose e-mail addresses are registered with the Company / Registrar and Share Transfer Agent ("RTA"), Depositories in accordance with the relevant Circular(s) issued by the Ministry of Corporate Affairs ("MCA") and the Securities and Exchange Board of India ("SEBI"). Members may note that the Notice of the AGM and Annual Report for the financial year 2022-23 will also be available on the Company's Website at https://www.dxc.com/in/en/about-us/xchanging-solutions-limited-investor-relations, websites of the stock exchanges i.e. National Stock Exchange of India Limited and BSE Limited at www.bseindia.com and www.bseindia.com respectively and website of KFin Technologies Limited ("KFin Technologies") at https://evoting.kfintech.com. The dispatch of the Notice of the AGM along with the Annual Report for the financial year ended March 31, 2023 has been completed on Tuesday, August 1, 2023.

Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, and Regulation 44 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the Members holding shares either in ysical form or dematerialized form, as on the Cut-off date i.e. Friday, August 18, 2023, may cast their vote electronically on the business as set forth in the Notice of the AGM through the Electronic Voting System ("Remote e-Voting / e-Voting") provided by KFin Technologies. The Members are informed that:

- I. The business as set forth in the Notice of the AGM may be transacte through voting by electronic means:
- ii. The Remote e-Voting shall commence on Tuesday, August 22, 2023 at 9:00 A.M. (IST) and shall end on Thursday, August 24, 2023 at 5:00 P.M. (IST). Remote E-voting module will be disabled after 5:00 P.M. (IST) on Thursday, August 24, 2023;
- iii. The Cut-off date for determining the eligibility to vote by Remote e-Voting or by e-Voting system at the AGM shall be Friday, August 18, 2023;
- iv. Any person who acquired shares of the Company and become a membe of the Company after the dispatch of the Notice of the AGM and holds shares as of the Cut-off date i.e. Friday, August 18, 2023, may obtain the login ID and password by sending a request at evoting@kintech.com However, if the person is already registered with KFin Technologies for e voting, then the existing user ID and password can be used for casting their
- v. Members may note that: (a) The Remote e-Voting module will be disabled by KFin Technologies, beyond 5:00 P.M. (IST) on Thursday, August 24 2023 and once the votes on resolution is cast by the member, he/she shall also be made available during the AGM and those members present in the AGM through VC facility, who have not cast their vote on the resolutions through Remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-Voting at the AGM; (c) The members who have cast their vote by Remote e-Voting may also attend the AGM but shall not be entitled to cast their vote again; (d) Only persons whose names are recorded in the Register of Members or in the Register of Beneficia Owners maintained by the depositories as on the Cut-off date shall be entitled to avail the facility of Remote e-Voting or e-Voting at the AGM; and (e) Members attending the AGM through VC/ OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies
- vi. The instructions for joining the AGM and detailed procedure for Remote e Voting / e-Voting for the members holding shares in dematerialized mode physical mode and for members who have not registered their emai addresses is provided in the Notice of the AGM;
- vii. Members whose email ids are already registered with the Company / RTA / Depository Participant ('DP'), may follow the instructions for remote e-Voting as well as e-Voting at AGM as provided in the AGM Notice Members holding the shares in physical and demat form who have no registered their e-mail addresses with the Company/ RTA or with the respective DPs can temporarily get their email IDs registered with the RTA by accessing the link: https://ris.kfintech.com/clientservices/mobilereg/mobileemailreg.aspx and follow the temporary registration process as guided thereafter, to receive the Notice of AGM and Annual Report for the financial year 2022-23 through email and/ or receiving instructions for Remote e-Voting and
- instructions for participation in the AGM through VC/ OAVM; and viii. In case of any queries, you may refer the Frequently Asked Questions ('FAQs') for the Members and 'Remote e-Voting User Manual' for Members available at downloads section of https://evoting.fintech.com or call on toll free no.: 1800 309 4001. In case of any gueries or grievances relating to e-voting, the Members may contact Mr. Anandan K, Manager at KFin Technologies Private Limited, Selenium Building, Tower B, Plot 31& 32, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad. Rangareddi, Telangana – 500032 at email id evoting@kfintech.com or call KFin Technologies's toll free No.: 1800 309 4001.

Pursuant to Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Record date is fixed as Friday, July 28, 2023 for determining the eligibility for the purpose of payment of Interim dividend for the financial year 2023-24 of Rs 15/- per equity share (150%) of face value of Rs 10/- each as recommended by the Board of Directors at its meeting held on July 10, 2023. A communication providing detailed information & instructions with respect to tax on the Interim Dividend for the FY 2022-23 is being sent separately to the Members. The said communication will also be made available on the Company's website. Further, the Shareholders are also requested to refer to the Notice of the AGM for more details on process to be followed from their side, if any, in this regard.

Date: August 1, 2023 Place: Delhi

For Xchanging Solutions Limited

Mayank Jain Company Secretary

Membership No: A26620

ઝાપટ માર્ગ, લોઅર પારેલ, મુંબઇ–૪૦૦૦**૧**૩ **રીટેલ એસેટ કલેક્શન એપાર્ટમેન્ટ** : ડીસીબી બેંક લીમીટેડ, ઓફીસ નં. ૩૦૨, સેલો પ્લેટીના, ત્રીજો માળ એફ્સી રોડ, પોલિસ ગ્રાઉન્ડ પાસે, શિવાજીનગર, પુને– ૪૧૧૦૦૫

રજીસ્ટર્ડ ઓફીસ : ડીસીબી બેંક લીમીટેડ, છ**ું**ો માળ, ટાવર એ, પેનિનસુલા બિઝનેશ પાર્ક, સેનાપતિ

_	ાંચ જણાવલ ાવગતા મુજબ દેવાદાર(રો) અને સહ-	ટેન્ડર સહ જાહેર ઈ-હરાજી દ્વારા વેચવામાં આવશે. મિલકત "જ્યાં છે સ્થાવર મિલકતની વિગત	િ., "જ છ" ના ધારણ વ રિઝર્વ કિંમત	યવામાં આવેશ. ઈએમડી	ઇ-હરાઝીની	કબજાનો
i.	દેવાદાર(રો) ના નામ	Edite Haston Hold	(રૂા.)	(३१.)	તારીખ	Nei5
l.	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિચા અને મેહુલભાઇ જાલાભાઇ સતિચા મારફત	બ્લોક નં. એ-૧૦૩, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ફર.૦૯ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં.૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૨ ચો.ફુટ, રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાચકપ્લોટની જમીનના તમામ ભાગઅને હિસ્સા.	Rs.26,31,000.00 (રૂપિયા છવ્વીસ લાખ એક્ત્રીસ હજાર પુરા)	Rs.2,63,100/-	49-06-53	ભૌતિક
2.	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા	બ્લોક નં. એ-૧૦૪, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ફર.૦લ્ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૨ ચો.મી, એટલે કે ૧૭૫૩ ચો.કૂટ, રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાચક પ્લોટની જમીનના વત્રામ ભાગ અને હિસ્સા.	Rs.27,24,000.00 (રૂપિયા સત્યાવીસ લાખ ચોવીસ હજાર પુરા)	Rs.2,72,400/-	99-06- 2 3	ભૌતિક
	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા	બ્લોક નં. બી-૧૦૩, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૧૦ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૧૫), કુલ ક્ષેત્રફળ, ૧૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૨ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુર, રજીસ્ટ્રેશન સબ કિસ્ટ્રીક્ટ અને ક્સિટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.19,35,000.00 (રૂપિયા ઓગણીસ લાખ પાંત્રીસ હજાર પુરા)	Rs.1,93,500/-	99-06-53	ભૌતિક
	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા	શોપ નં. ૧૦૭, પેહલો માળ, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૩૯.૦૩ ચો.મી. ની સ્થાવર મિલકત. મોર્જ ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૦ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુટ, રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાચક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.24,23,000.00 (રૂપિયા ચોવીસ લાખ ત્રેવીસ હજાર પુરા)	Rs.2,42,300/-	49−06−€3	ભૌતિક
i.	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિચા અને મેહુલભાઇ જાલાભાઇ સતિચા	વર્મામ ભાગ અને હિસ્સા. પ્લોક નં. એ- રુબ, આનંદિકરણ, કુલ બિલ્ટ અપ એરિયા ફર. હત્યો.મી. ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, પ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૨ ચો.મી, એટલે કે ૧૭૫૩ ચો.કૂર, રુજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.25,84,000.00 (રૂપિયા પચ્ચીસ લાખ ચૌર્યાશી હજાર પુરા)	Rs.2,58,400/-	49-06- 2 3	ભૌતિક
	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા	ળ્લોક નં. એ–૨૦૪, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૬૨.૦૯ ચો.મી. ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાંગિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રકળ ૧૬૨૦ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુર, ૨૭૫૩-ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.25,84,000.00 (રૂપિયા પચ્ચીસ લાખ ચૌર્ચાશી હજાર પુરા)	10.2,00,100		ભૌતિક
	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં. એ-૩૦૨, આનંદકિરણ, કુવ બિલ્ટ અપ એરિયા ફર.૦૬ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં.૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. લ્પ), કુલ ક્ષેત્રકળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ર, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુટ, ૨૪૪૨ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગઅને હિસ્સા.	Rs.25,84,000.00 (રૂપિયા પચ્ચીસ લાખ ચૌર્યાશી હજાર પુરા)	Rs.2,58,400/-	99-06-53	
8	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં.એ-3૦૪, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ફર.૦૯ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુટ, રઝસ્ટ્રેશન સબ કિસ્ટ્રીક્ટ અને કિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાચક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.25,84,000.00 (રૂપિયા પચ્ચીસ લાખ ચૌર્યાશી હજાર પુરા)	Rs.2,58,400/-	99-06-€3	ભૌતિક
9	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં.એ–૪૦૧, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ફર.૦૯ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુંટ, ૨૭૫૨ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના	Rs.25,84,000.00 (રૂપિયા પચ્ચીસ લાખ ચૌર્યાશી હજાર પુરા)	Rs.2,58,400/-	49-06- 2 3	ભૌતિક
D	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિચા અને મેહુલભાઇ જાલાભાઇ સતિચા મારફત	તમામ ભાગ અને હિસ્સા. ગ્લોક નં. એ-૪૦૨, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ફર.૦૯ સો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, હતા નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રફળ, ૨૩૨૭ સો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ સો.મી, એટલે કે ૧૭૫૪ સો.ફુંટ, રુપુરદ્દેશન સબ કિસ્ટ્રીક્ટ અને કિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.25,84,000.00 (રૂપિયા પચ્ચીસ લાખ ચૌર્યાશી હજાર પુરા)	Rs.2,58,400/-	49-06- 2 3	ભૌતિક
1	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં.એ-૪૦૪, આનંદકિરણ, કુવ બિલ્ટ અપ એરિયા ફર.૦૯ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કૂર, રણસ્ટ્રેશન સબ કિસ્ટ્રીક્ટ અને ક્સ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જ્મીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.25,84,000.00 (રૂપિયા પચ્ચીસ લાખ ચૌર્યાશી હજાર પુરા)	Rs.2,58,400/-	99-06-€3	ભૌતિક
	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુવભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં. એ-૫૦૩, આનંદકિરણ, કુવ બિલ્ટ અપ એરિયા દ્ ર.૦૬ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં.૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં.૨૫), કુલ ક્ષેત્રફળ ર૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ર, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુટ, રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાચક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.36,74,000.00 (રૂપિયા છત્રીસ લાખ ચુંમોતેર હજાર પુરા)	Rs.3,67,400/-	99−06−53	ભૌતિક
	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં. એ-૫૦૪, આનંદકિટણ, કુવ બિલ્ટ અપ એરિયા ફર.૦૯ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં .૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકળ ર૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.ફુટ, ૨જીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની બ્મીનના તમામ ભાગ અને હિસ્સા.	(રૂપિયા છત્રીસ લાખ ચુંમોત્તેર હજાર પુરા)	Rs.3,67,400/-	4 9−0€− 2 3	ભૌતિક
	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુવભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં. બી-૧૦૧, આનંદિકેરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્તે નં. ૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કૂટ, ટ્યુસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતની બિન ખેતીલાચક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	(રૂપિયાં ઓગણીસ લાખ પાંત્રીસ હજાર પુરા)	Rs.1,93,500/-	49-06- 2 3	ભૌતિક
5	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં. બી-૧૦૨, આનંદિકેટણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રકળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩ ચો.કૂટ, ટજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	(રૂપિયા ઓગણીસ લાખ પાંત્રીસ હજાર પુરા)	Rs.1,93,500/-	99-06-€3	ભૌતિક
6	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં. બી–૧૦૪, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકળ રકરુ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રકળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૪ ચો.કુર, રજીસ્ટ્રેશન સબ ઉસ્ટ્રીક્ટ અને ડ્રિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.19,35,000.00 (રૂપિયા ઓગણીસ લાખ પાંત્રીસ હજાર પુરા)	Rs.1,93,500/-	49−06− €3	ભૌતિક
7	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારકત	લ્લોક નં. બી-૨૦૪, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬, પ૦ ચો. મી. ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્ચુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકળ ૨૩૨૭ ચો. મી, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો. મી, એટલે કે ૧૭૫૩૪ ચો. કુટ, રજીસ્ટેશન સબ હિસ્ટીક્ટ અને હિસ્ટીક્ટ	Rs.19,35,000.00 (રૂપિયા ઓગણીસ લાખ પાંત્રીસ હજાર પુરા)	Rs.1,93,500/-	99−0€− €3	ભૌતિક

DCB BANK

મેસર્સ સમીર બિલ્ડર્સ બ્લોક નં. બી-૪૦૨, આનંદિકરણ, કુલ બિલ્ટ અપ એરિયા જિ.19,35,000.00 જિ.1,93,500/બલાભાઇ રેલાભાઇ જદ્દ,૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજ ભાચલી, વડોદરા, બલોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેલન્થુ સર્વે નં. ૯૫), કુલ સેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૨, મેઠલભાઇ જાલાભાઇ કાઇનલ પ્લોટનં. ૯૬. સેત્રફળ ૧૬૨૬ ચો.મી. એરલે કે ભૌતિક

		સાતચા અન મેહુલભાઇ જાલાભાઇ સતિચા મારફત	ક્ષેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લૉનિંગ સ્કીમ નં. રે, કાઇનલ પ્લોટનં. ૬૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુટ, ૨૭૪૨ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જ્મીનના તમામ ભાગ અને હિસ્સા.	ઓગણીસ લાખ પાંત્રીસ હજાર પુરા)			
ોરીટી ત માટે જાનો કાર	20	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં. બી-૪૦૩, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ સેત્રકળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુટ, રઝસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની છિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્ટ્રા.	Rs.19,35,000.00 (રૂપિયા ઓગણીસ લાખ પાંત્રીસ હજાર પુરા)	Rs.1,93,500/-	99-06-53	ભૌતિક
તિક	21	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં. ળી-૫૦૨, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ શો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ શો.મી, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૮ શો.મી, એટલે કે ૧૭૫૪ શો.કુટ, રુઝરેટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ ડાડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.19,35,000.00 (રૂપિચા ઓગણીસ લાખ પાંત્રીસ હજાર પુરા)	Rs.1,93,500/-	4 9−0€− 2 3	ભૌતિક
	22.	મેસર્સ સમીર બિલ્ડર્સ જલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં. બી-૫૦૩, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ ચો.મી. ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૧૫), કુલ સેત્રકળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૨ ચો.કુટ, રઝરેટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્ટ્રા.	Rs.19,35,000.00 (રૂપિયા ઓગણીસ લાખ પાંત્રીસ હજાર પુરા)	Rs.1,93,500/-	49-06-23	ભૌતિક
તિક	23	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	લ્લોક નં. સી-૧૦૧, આનંદકિરણ, કુવ બિલ્ટ આ એરિયા ૪૬,૫૦ શો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં.૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં.૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ શો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ શો.મી, એટલે કે ૧૭૫૩૪ શો.કુટ, જુણ્ટરેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયકપ્લોટની જ્મીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.20,50,000.00 (રૂપિયા વીસ લાખ પચ્ચાસ હજાર પુરા)	Rs.2,05,000/-	99-06-53	ભૌતિક
	24.	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	ળ્લોક નં. સી-૧૦૨, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૨ ચો.કુટ, જુસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયકપ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.20,50,000.00 (રૂપિચા વીસ લાખ પચ્ચાસ હજાર પુરા)	Rs.2,05,000/-	49-06-23	ભૌતિક
તિક	25.	મેસર્સ સમીર બિલ્ડર્સ જલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	વ્લોક નં. સી-૧૦૩, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં.૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં.૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુટ, રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન્ખેલીલાયકપ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.20,50,000.00 (રૂપિયા વીસ લાખ પચ્ચાસ હજાર પુરા)	Rs.2,05,000/-	49−0€− ₹3	ભૌતિક
તિક	26.	મેસર્સ સમીર બિલ્ડર્સ જલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં. સી-૨૦૨, આનંદકિરણ, કુવ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૨ ચો.કુટ, દજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાચકપ્લોટની જ્મીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.20,50,000.00 (રૂપિચા વીસ લાખ પસ્થાસ હજાર પુરા)	Rs.2,05,000/-	99-06- 2 3	ભૌતિક
તિક	27	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	ળ્લોક નં. સી–૩૦૧, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં.૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. લ્પ), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ર, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુટ, રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.19,46,000.00 (રૂપિયા ઓગણીસ લાખ છેતાલીસ હજાર પુરા)	Rs.1,94,600/-	99-06-53	ભૌતિક
	28	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	બ્લોક નં. સી-૩૦૪, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬,૫૦ શો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ શો.મી, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ શો.મી, એટલે કે ૧૭૫૩ શો.કુટ, ટપ્પુર્સ્ટ્રશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જ્મીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.19,46,000.00 (રૂપિયા ઓગણીસ લાખ છેતાલીસ હજાર પુરા)	Rs.1,94,600/-	49-oe- 2 3	ભૌતિક
તિક	29	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	ળ્લોક નં.સી-૪૦૩, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૪૬.૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોર્જ ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકુળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુર, રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જ્મીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.19,80,000.00 (રૂપિયા ઓગણીસ લાખ એંશી હજાર પુરા)	Rs.1,98,000/-	49-06-23	ભૌતિક
િ -	30	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુવભાઇ જાલાભાઇ સતિયા મારફત	શોપ નં. ૧૦૧, પહેલો માળ, આનંદિકરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૩૯.૦૩ શો.મી.ની સ્થાવર મિલકત. મોરું ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકળ ૨૩૨૭ શો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ શો.મી, એટલે કે ૧૭૫૩૪ શો.કુર, રણસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.24,23,000.00 (રૂપિયા ચોવીસ લાખ ત્રેવીસ હજાર પુરા)	Rs.2,42,300/-	99-06-53	ભૌતિક
તિક	31	મેસર્સ સમીર બિલ્ડર્સ જલાભાઇ રેવાભાઇ સતિયા અને મેલુવભાઇ જાલાભાઇ સતિયા મારફત	શોપ નં. ૧૦૨, પહેલો માળ, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા રદ્દ.૦૨ ચો.મી. ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકુળ ૨૩૨૦ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુટ, રખુટેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની ભેન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.16,15,000.00 (રૂપિચા સોળ લાખ પંદર હજાર પુરા)	Rs.1,61,500/-	49-06-23	ભૌતિક
તિક	32	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	શોપ નં. ૧૦૩, પહેલો માળ, આનંદિકરણ, કુલ બિલ્ટ અપ એરિચા રપ.લ્૩ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકૃળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રકૃળ ૧૬૨૨ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુટ, રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.16,09,000.00 (રૂપિયા સોળ લાખ નવ હજાર પુરા)	Rs.1,60,900/-	99-06-53	ભૌતિક
તિક	33	મેસર્સ સમીર બિલ્કર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	શોપ નં. ૧૦૪, પહેલો માળ, આનંદિકરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૧૩.૮૦ શો.મી. ની સ્થાવર મિલકત. મોર્જ ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.કુટ, ૨૭૫૨ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના	Rs.8,56,000.00 (રૂપિચા આઠ લાખ છપ્પન હજાર પુરા)	Rs.85,600/-	9-06-53	ભૌતિક
તિક	34	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	તમામ ભાગ અને હિસ્સા. શોપ નં. ૧૦૫, પહેલો માળ, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા ૨૨.૦૩ ચો.મી. ની સ્થાવર મિલકત. મોરું ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રકળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, કાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૦ ચો.મી, એટલે કે ૧૭૫૩૪ ચો.ફુટ, ૨૭૪૨ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ	Rs.13,67,000.00 (રૂપિયા તેર લાખ સડ્સઠ હજાર પુરા)	Rs.1,36,700/-	49-06-43	ભૌતિક
	35	મેસર્સ સમીર બિલ્ડર્સ જાલાભાઇ રેવાભાઇ સતિયા અને મેહુલભાઇ જાલાભાઇ સતિયા મારફત	વડોદરા ખાતેની બિને ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા. શોપ નં. ૧૦૬, પહેલો માળ, આનંદિકરણ, કુલ બિલ્ટ અપ એરિયા રદ, ૦૨ શો.મી. ની સ્થાવર મિલકત. મોજે ભાચલી, વડોદરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧ (જાો રેવન્યુ સર્વે નં. ૯૫), કુલ ક્ષેત્રફળ ૨૩૨૭ શો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ શો.મી, એટલે કે ૧૭૫૩૪ શો.કુટ, ૨૭૫૨ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા.	Rs.17,13,000.00 (રૂપિયા સત્તર લાખ તેર હજાર પુરા)	Rs.1,71,300/-	49-06-53	ભૌતિક
તિક	(૧ દ્વા પહે (૨	રા "ઓનલાઇન ઇ–હરા કેલા હરાજી વેચાણની વિ ક) રસ ધરાવતા બીડરોને	િ નયમો ાટના અનલીમીટેડ એક્સટેન્શન સાથે ઉપર કોષ્ટકમાં જણા ાજી" બીડીંગ દ્વારા વેચવામાં આવશે. બીડરોને તેમની બીડો વ ાગતવાર શરતો અને નિચમો માટે વેબસાઇટ https://sarfae ને સર્વિસ પ્રદાતા (મેસર્સ ઈ–પ્રોક્ચુરમેન્ટ ટેકનોલોજી લીમીટે: આઇડી અને પાસવર્ડ મેળવી લેવા વિનંતી છે. (ટેલિ: ૦૭૯ દુદ	જમા કરતા પહેલા અ esi.auctiontiger.net s (ઓક્શન ટાઇગર	ને ઇ–હરાજી વેચ જોવા સલાહ છે) અમદાવાદના	ાણ પ્રક્રિયામ પોર્ટલ પર તેમ્	ાં ભાગ લેતા નનું રજીસ્ટર

ક્ટવાને પહેલેથી લોગીન આઇડી અને પાસવર્ડ મેળવી લેવા વિનંતી છે. (ટેલિ: ૦૭૯ ૬૮૧૩ ૬૮૩૭/૮૦/૯૦ (મો) ૯૨૬૫૫૬૨૮૨૮ ૯૨૬૫૫૬૨૮૧૮) સંપર્ક વ્યક્તિઃ શ્રી ચિંતન ભટ્ટ નં. ૯૯૭૮૫૯૧૮૮૮, ઇમેઇલ: chintan.Bhatt@Auctiontiger.Net, Support@Auctiontiger.Net. નોંધ લેવી કે, ભાવી બીડરો ફક્ત તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી જ ઈ–હરાજી અંગે ઓનલાઇન તાલીમ મેળવી શકે છે.

(૩) હરાજી પ્રક્રિયામાં ઓનલાઇન ઇ–હરાજી ભાગીદારી નિયત નમૂનામાં અરજી કરવી ફરજિયાત છે, જે ઓફર/ટેન્ડર દસ્તાવેજો સાથે વેબસાઇ

(૪) બીડરોને તેમની બીડ જમા કરતાં પહેલા લિંક https://www.Dcbbank.Com/Cms/Showpage/Page/Customer-Comer માં હરાજી વેચાણની વેગતવાર શરતો અને નિચમો જોવા સલાહ છે અને વધુ વિગતો માટે શ્રી પ્રશાંત એચ જોષી/વિલાસ બી ઢેબે ડીસીબી બેંકના અધિકૃત અધિકારીઓને ૦૨૦૬૭૨૫૩૦૮૭/૦૨૦૬૭૨૫૩૦૦૧/૦૦૩ ઉપર સીધો સંપર્ક કરી શકાશે.

ઉપરોક્ત નોટીસમાં દર્શાવેલ તમામ સામગ્રીઓ અંગે વધુ સ્પષ્ટતા માટે, અંગ્રેજી ભાષામાં પ્રકાશિત નોટીસને માન્ય ગણવામાં આવશે. તારીખ : ૦૧–૦૮–૨૦૨૩ સહી/– અદ્યિકૃત અદ્યિકારી શ્થળ : વડોદરા

Continued from previous page....



KFIN TECHNOLOGIES LIMITED

Selenium Tower B Plot 31-32 Gachibowli Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad,

અલાભાઇ ટેવાભાઇ

મેહલભાઇ જાલાભાદ

સતિયા મારફત

સતિયા અને

તમામ ભાગ અને હિસ્સા.

બ્લોક નં. બી–૩૦૨, આનંદકિરણ, કુલ બિલ્ટ અપ એરિયા Rs.19,35,000.00

પ્લાક ન. ખા–૩૦૨, આપ્લાકારા, યુ... ૪૬.૫૦ ચો.મી.ની સ્થાવર મિલકત. મોજભાચલી, વડોદરા, (રૂપિયા ઓગણીસ

ળ્લોક નં. ૭૧ પૈકી ૧ (જુનો રેવન્થુ સર્વે નં. ૯૫), કુર્લ ક્ષેત્રફળ ૨૩૨૭ ચો.મી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨,

ફાઇનલ પ્લોટનં. ૯૬, ક્ષેત્રફળ ૧૬૨૯ ચો.મી, એટલે કે

૧૭૫૩૪ ચો.કુટ, ૨જીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ

વડોદરા ખાતેની બિન ખેતીલાયક પ્લોટની જમીનન

Telangana- 500032, India. Tel No: +91 40 6716 2222/18003094001 Fax No: +91 40 2343 1551 E-mail Id: yasons.ipo@kfintech.com Website: www.kfintech.com

Investor Grievance ID:einward.ris@kfintech.com

Contact Person: M.Murali Krishna

SEBI Registration No: INR000000221

Date: August 01, 2023 Place: Guirat

Rs.1,93,500/- **૧૭–૦૯–૨૩** ભૌતિક

FOR YASONS CHEMEX CARE LIMITED On behalf of the Board of Directors

> Pritesh Yashwantlal Shah Managing Director DIN: 00239665

THE LEVEL OF SUBSCRIPTION SHOULD NOT BE TAKEN TO BE INDICATIVE OF EITHER THE MARKET PRICE OF THE EQUITY SHARES ON LISTING OR THE BUSINESS PROSPECTS OF YASONS CHEMEX CARE LIMITED. The Equity Shares have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended ("US Securities Act") or any other state securities laws in the United

States of America and may not be sold or offered within the United States of America, or to, or for the account or benefit of "US Persons" as defined in Regulation S of the U.S. Securities Act, except pursuant to exemption from, or in a transaction not subject to, the registration requirements of US Securities Act and applicable state securities laws The Equity Shares have not been and will not be registered, listed or otherwise qualified in any other jurisdiction outside India and may not be offered or sold, and Application may not be made by persons in any such jurisdiction, except in compliance with the applicable laws of such jurisdiction.

Sunjeet Comm